

સંસારી આત્માને મોક્ષ (કર્મમુક્ત અવસ્થા) સાથે જોડી આપે તે યોગ, આત્માની ઉદ્વારોહણાની સાધના પ્રક્રિયા પણ યોગ જ કહેવાય છે. સંસારોન્મુખ બતેલો, સંયમ-વૈરાગ્ય-તપ-ઈત્યાદિ દ્વારા આત્મ સન્મુખ બનવા જૈન આચાર્યોએ યોગ ઉપર ઊંડુ વિશાદ ચિંતન-સાધનાથી પ્રકાર બેદ કરેલું છે. પૂ. હરિભદ્રસૂરીજી મ.સા, કલિકાલ સર્વજ્ઞ હેમયંદ્રાચાર્ય અને ઉપા યશોવિજય મ.સા. આદિએ યોગસાધકો માટે વિશિષ્ટ વર્ણન કર્યા છે.

યોગદ્રષ્ટિઓ સામાન્યતા: આઠ છે. જે નીચે પ્રમાણે છે.

૧. મિત્રાદ્ધિ :

આ દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી સાધક સત્ત શ્રદ્ધાની તરફ સન્મુખ થાય છે. તેને જે પદાર્થનો બોધ થાય છે, તે મંદતા વાળો રહે છે મિત્રાદ્ધિવાળો સાધક યોગનું પ્રથમ અંગ યમના વિવિધ રૂપોનો પ્રારંભિક અભ્યાસ કરી લે છે. વ્યક્તિ આભોક્ષતિના હેતુભૂત અન્ય યોગ બીજોનો સ્વીમર કરે છે.

આ દ્રષ્ટિમાં દર્શાન મોહનીય મિથ્યાત્વ કે અવિદ્યાના વિપર્યાસમાં આત્મગુણોનું સ્કુરણ તથા અન્તર્વિકાસની દિશામાં પ્રારંભ થાય છે. આ આદ્યાભ્યોગાની પહેલી દરા છે. જેમાં દ્રષ્ટિ પૂર્ણતઃ સમ્યક્ થઈ શકતી નથી, પરંતુ અહિંથી અન્તર્જીવારણ અને ગુણાત્મક પ્રગાતિની પાત્રાનો શુભારમ્ભ થાય છે. આ દ્રષ્ટિમાં ગુણીજનોના તરફ આદર, અનુકરણ, દુઃખીઓના તરફ કરણા અને સત્કાર્યો તરફ આદરભાવ ઉત્પણ થાય છે.

૨. તારાદ્ધિ:

આ દ્રષ્ટિ યોગનું બીજું અંગ ‘નિયમ’ સાધે છે. શૌય, સંસ્કાર, તપ, સ્વાધ્યાય અને આત્મચિંતન જીવનમાં પ્રગાતવા લાગે છે. આત્મહિતની પ્રવૃત્તિમાં ઉત્સાહ અને તત્ત્વોન્મુખી જિજ્ઞાસા ઉપ્લબ્ધ થાય છે. તથા સાધક યોગચાર્યામાં અભિરૂચિ ધરાવે છે તારા દ્રષ્ટિનાં સાધકને જન્મ, મરણ રૂપ આવાગમન કિયાનો અત્યંત ભય નથી હોતો. અજાણતા પણ તેનાથી કોઈ અનુચિત કિયા નથી થઈને તેની જાગૃતિ છે. તે મનમાં કોઈ પ્રત્યે દ્રોષ ભાવ લાવતો નથી તે સાત્ત્વિક ચિંતનની દિશામાં ક્રમશા: આગામ વધે છે.

૩. બલાદ્ધિ :

આ યોગનું ત્રીજું અંગ ‘આસન’ સાધે છે. આમાં સુખાસન યુક્ત દટ દર્શાન પ્રાપ્ત થાય છે. તત્ત્વ શ્રવણની તીવ્ર દર્શા જાગે છે. અને સાધનામાં અદ્રો-ક્ષોપ નામનો દોષ આવતો નથી. આ દ્રષ્ટિના વિકાસથી અસત્ત પદાર્થો તરફ તૃપ્તણાની સહજ પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. સાધક સર્વત્ર સુખમવતાનો અનુભવ કરવા લાગે છે. સાધકના જીવનમાં સ્થિરતાનો સુખદ સમાવેશ થાય છે. તેની સમર્પણ કિયાઓ નિર્બાધ (બાધારહિત) થવા લાગે છે. બલા દ્રષ્ટિના વિકાસથી યોગીના ધ્યાન, ચિન્તાન, મનન આદિ શુભ કર્મોમાં વિઝોપ આવતો નથી તે શુભ સમારભ્યમય ઉપકરણમાં કુશળતા પ્રાપ્ત કરતો જાય છે. તે સાધ્ય પ્રાણિના લક્ષ્યની તરફ સંદેશ પ્રપાસનત રહે છે. પાપપૂર્ણ પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરી દે છે. ઉત્કૃષ્ટ-આત્મ-અભ્યુદય સધાય છે.

૪. દીપ્રાદિષ્ટ :

આનાથી યોગનું ચોથું અંગ 'પ્રાણાયામ' સધાય છે. ચિત્ત, યોગથી વિરત થતું નથી. આનાથી તત્ત્વ-શ્રવણ સધાય છે. માત્ર શ્રવણથી જ નહીં, પરંતુ અન્તઃ કરણથી આ રૂચિ થાય છે. આમાં અન્તાગ્રહિતાના ભાવો ઉદ્દિત થાય છે. દિપ્રા દિષ્ટિના સાધકને માનસિક અને બૌધિક સ્તર એટલું ઊંચું થઈ જાય છે કે તે ધર્મને નિશ્ચિત રૂપથી પ્રાણોથી પણ અધિક સમજે છે. પ્રાણાયાતક સંકટ આવવા છતાં પણ તે ધર્મને છોડતો નથી આ સાધક સાતવિક ભાવોથી આરચ્છાદિત થઈ જાય છે તે તત્ત્વ-શ્રવણના માધ્યમથી પોતાના કલ્યાણ તરફ સજાગ રહે છે. આનાથી ગુરુભન્તિ રૂપ સુખ પ્રાપ્ત થાય છે અને લૌકિક અને પારલૌકિક બજે હિત સધાય છે.

૫. સ્થિરાદિષ્ટ :

આ દિષ્ટથી યોગનું 'પ્રત્યાહાર' અંગ સધાય છે. શ્રુત, તર્ક અને આત્માનુભવથી શ્રદ્ધા દૃઢ થાય છે. પ્રત્યાહારથી સ્વ-સ્વ વિષયોના સમ્બન્ધથી વિરત થઈને ઈન્દ્રિયો અને ચિત્ત સ્વરૂપાનું સાર પ્રતીત થવા લાગે છે, તથા સાધક દ્વારા કરવામાં આવતા ફૂલ્યો, નિભન્તિ, નિર્દોષ તથા સુક્ષમ બોધ ચુક્ત થાય છે. આ દિષ્ટમાં 'વેદ-સંબંધ-પદ'ની પ્રધાનતા આવી જાય છે. આ દિષ્ટિના બે પ્રકાર માનવામાં આવ્યા છે. નિરતિયાર અને સાતિયાર નિરતિયાર દિષ્ટમાં અતિયાર કે વિદ્ધન આવતા નથી. આમાં શ્રદ્ધા પ્રતિપાતરહિત અને અવસ્થિત રહે છે. સાતિયાર દિષ્ટમાં દર્શન અનિત્ય તથા અનવસ્થિત રહે છે. સ્થિરા દિષ્ટિના સાધક સમ્યક્-દિષ્ટ પુરુષના અજ્ઞાનાન્ધકારની ગુંથિનું વિભેદન થઈ જાય છે. આ દિષ્ટવાળા યોગીમાં શાસન-પ્રસૂત વિવેક જાગૃત થાય છે. તે દેહ, ઘર, પરિવાર, વૈભવ આદિ બાહ્ય ભાવોને મૃગતૃષ્ણા, ગંધર્વ નગાર કે કલ્યાણાના રૂપમાં માને છે. તેને સાંસારિક ભાવોની વાસ્તવિકતાનું તથય (સત્ય)પૂર્ણ દર્શન થઈ જાય છે. આ દિષ્ટમાં સ્વ-પર-ભેદ-વિજ્ઞાન પ્રાપ્ત વિવેકી અને પ્રત્યાહાર પરાયણ હોય છે અને ધર્માર્થાધનમાં આવવાવાળી બાધાઓના પરિહારમાં પ્રયત્નશીલ રહે છે.

૬. કાન્તાદિષ્ટ :

આ દિષ્ટમાં સમ્યક્ દર્શન, અવિરચ્છન્ન થઈ જાય છે. આ દિષ્ટમાં સ્થિત યોગી ધર્મનો મહિમાં તથા સમ્યક્ આચારની વિશુદ્ધિના કારણે બધાને પ્રિય થાય છે. તેને યોગનું છફું અંગ ધારણ થઈ જાય છે. આ દિષ્ટિના યોગીની આત્મધર્મ ભાવના એટલી દૃઢ હોય છે કે તે શરીરથી બીજા કાર્યોમાં લાગ્યા રહેવા છતાં પણ મનથી સહેવ સદ્ગુરુ પ્રવીણ આગમમાં તલ્લીન રહે છે. આત્મભાવની તરફ આકૃષ્ટ રહે છે. તે અનાસક્ત થઈ જાય છે. આનાથી સાંસારિક ભોગ તેને જન્મ-મરણ ચક્રમાં ભટકાવવાવાળા નથી બનતાં. આ દિષ્ટમાં સ્થિત સાધક સહેવ તત્ત્વચિંતન તથા તત્ત્વમીમાંસામાં લાગ્યો રહે છે. આથી તેને મોહ વ્યાપ નથી થતો. તેને યથાર્થ બોધ પ્રાપ્ત થઈ જવાથી ઉત્તરોત્તર આભાહિત સધાય છે.

૭. પ્રભાદિષ્ટિ :

પ્રભાદિષ્ટિ પ્રત્યક્ષા દ્યાનપ્રિય છે. આમાં યોગી દ્યાનરત રહે છે. યોગનું સાતમું અંગ ‘દ્યાન’ સધાય છે. રાગ, ક્ષેષ, મોહ, ત્રિદોષ રૂપ ભાવ રોગ અહિં વિદન આવતા નથી. આ દિષ્ટિમાં દ્યાન જન્ય સુખનો અનુભવ થાય છે. આ રૂપ, શબ્દ, સ્પર્શ આદિ કામ-વિષયોને જુતવાવાળી છે. આ દ્યાન-સુખ વિવેક આદિબળની તીવ્રતાથી ઉત્પદ્ધ થાય છે. આમાં પ્રશાંત ભાવની પ્રધાનતા રહે છે. આની સાત પ્રવૃત્તિની સંજ્ઞા અસંગાનુંઝાન કહેવાય છે. આ ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે.- પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગા, સમગ્ર પ્રકારના સંગા, આસક્તિ કે સંસ્પર્શથી રહીત આત્માનુંચરણ અસંગાનુઝાન છે. એને અનાલઘ્નન યોગ પણ કહેવામાં આવે છે. આનાથી શાશ્વત પદ પ્રાપ્ત થાય છે. આ મહાગ્રંથ પ્રચાણાનું અંતિમ પૂર્વભિન્ન છે.

૮. પરા દિષ્ટિ :

આનાથી યોગનું આઠમું અંગ ‘સમાધિ’ સધાય છે. આમા અ-સંગાતા પૂર્ણ થાય છે. આમાં આત્મતત્ત્વની સહજ અનુભૂતિ થાય છે તેને અનુરૂપ જ સહજ પ્રવૃત્તિ અને આચરણ થાય છે. આમાં ચિત્ત પ્રવૃત્તિ સ્થિર થઈ જાય છે. અને એમાં કોઈ વાસના નથી રહેતી આ દિષ્ટિમાં યોગી નિરતિચાર હોય છે તે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે. તે સર્વજ્ઞા, સર્વદર્શી, અને અયોગી થઈ જાય છે.

આ દિષ્ટિમાં તારતમ્યમાં હરિભદ્રે યોગિયોને ચાર કોટિયોમાં વર્ગીકૃત કર્યા છે. ગોત્ર યોગી, કુલ યોગી, પ્રવૃત્તાચક યોગી અને નિષ્પત્ત યોગી પ્રથમ શ્રેણીના યોગી કચારેય પૂર્ણ આત્મલાભ કરી શકતા નથી અને ચતુર્થ શ્રેણીના યોગી આત્મલાભ પ્રાપ્ત કરે છે.

ફલત: યોગ વિદ્યા માત્ર જ્ઞાતીય અને તૃતીય શ્રેણીના માટે જ માનવામાં આવે છે.